

રાય યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. 23 ફેબ્રુઆરી, 2019ના રોજ ઇન્ટરનેશનલ કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 23 ફેબ્રુઆરી, 2019ના રોજ 'ગ્લોબલ ચેલેન્જીસ એન્ડ ઇનોવેશન ઈન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ' પર ઇન્ટરનેશનલ કોનફરન્સ યોજાઈ જેમાં વિવિધ નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

યુનિવર્સિટીનાં સભાગૃહમાં આંતરરાષ્ટ્રીય પરીષદનું આયોજન કરવામાં આવેલું. પ્રો. અનિલ તોમર (ડેપ્યુટી પ્રોવોસ્ટ & રજિસ્ટ્રાર, રાય યુનિવર્સિટી), ડૉ. માઈકલ લોઈસ ફ્લોરેસ (ફાઉન્ડેશન ગવર્નર, સેન્ટ એન્થોની'ઝ એકેડેમી, લંડન, યુ.કે.), શ્રી નિલેશ દેસાઈ (વૈજ્ઞાનિક અને એસોસિયેટ ડિરેક્ટર, SAC -ઈસરો, અમદાવાદ), ડૉ. વિરંચી શાહ (ડિરેક્ટર, સાગા લેબોરેટરીઝ, ચેરમેન GSB IDMA), ચેક રિપબ્લિકમાંથી ડૉ. બોહદાન લિન્ડા (ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ એન્ડ ક્વોન્ટિટેટિવ મેથડ્સ, યુનિવર્સિટી ઓફ પારડુબિસ), ડૉ. મિલોસ્લાવ હબ, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્ટમ એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેટિક્સ, યુનિવર્સિટી ઓફ પારડુબિસ), કોન્ફરન્સ સેક્રેટરી પ્રો. આશિષ રામી અને વિરેન્દ્ર સિંઘ, કોન્ફરન્સ ચેર પ્રો. (ડૉ.)પરેશ શાહ અને પ્રો. (ડૉ.) પ્રદીપ ઝા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે સરસ્વતી વંદના કરવામાં આવી.

કાર્યક્રમનો આરંભ પ્રો. અનિલ તોમર (ડેપ્યુટી પ્રોવોસ્ટ & રજિસ્ટ્રાર, રાય યુનિવર્સિટી) દ્વારા લોકોનાં અભિવાદન દ્વારા શરૂ થયો. ત્યારબાદ પ્રસ્તાવના અને સંશોધનપત્રોનાં સંકલનનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું.

પ્રો. (ડૉ.) પ્રદીપ ઝા એ લોકોને વૈશ્વિક સમસ્યાઓ અને વૈજ્ઞાનિક નાવીન્ય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. શ્રી નિલેશ દેસાઈએ લોકપરિવહનમાં રિમોટ સેન્સિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે માહિતી આપી. ડૉ. વિરંચી શાહએ 'Cheaper, Faster and Simpler'નો ખ્યાલની લોકોને સમજ આપી. ડૉ. માઈકલ લોઈસ ફ્લોરેસએ બદલાવની જરૂરીઆત પર પોતાના વિચારો રજૂ કર્યા.

ચેક રિપબ્લિકમાંથી ડૉ. બોહદાન લિન્ડા અને ડૉ. મિલોસ્લાવ હબએ વિજ્ઞાન અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં તાજેતરના ફેરફારો અને વિકાસ અંગે પોતાનું જ્ઞાન વહેંચ્યું.

મધ્યાહ્ન બાદ વિવિધ સ્પર્ધકો દ્વારા વિવિધ ક્ષેત્રનાં સંશોધનપત્રો પર પોતાનાં મંતવ્ય પ્રસ્તુત કર્યાં. ડૉ. કિશોર ભાનુશાલી અને ડૉ. આરતી ઠક્કરએ અનુક્રમે મેનેજમેન્ટ અને સાયન્સના વિશેષજ્ઞ તરીકે બજાવેલી ફરજ પર સંક્ષિપ્તમાં પોતાનાં વિચારો રજૂ કર્યાં.

પ્રો. અનિલ તોમર દ્વારા શ્રેષ્ઠ પેપર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક અને ઉદ્યોગ વિભાગમાં ડૉ. નિહારિકા શાહ (વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) અને વિદ્યાર્થી વિભાગમાં કુંદન બ્રાહ્મણીયાને શ્રેષ્ઠ સંશોધનપત્ર માટે પુરસ્કૃત કરાયા.

બધા પ્રતિનિધિઓને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. પ્રો. વીરેન્દ્ર સિંહ નાગોરિયા દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઇન્ટરનેશનલ કોનફેરન્સમાં દેશ-વિદેશમાંથી વિવિધ નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલાં 90 સંશોધનપત્રોમાંથી 63 સંશોધનપત્રો પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા. ફાઇનાન્સ, ઇકોનોમિક્સ, માર્કેટિંગ, એચ.આર અને ગવર્નન્સ પોલિસી, આઇટી અને ઓપરેશન્સ, આંતરરાષ્ટ્રીય વેપાર, સ્ટ્રેટેજી અને એન્ટ્રપ્રિન્યરશીપ, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પર સંશોધનપત્રો રજૂ કરવામાં આવ્યા. RUICON-2019ને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. આંતરરાષ્ટ્રીય પરિષદ સફળ આયોજન અને સંકલન માટે તમામ કોઓર્ડિનેટર, સમિતિઓ, સ્ટાફ સભ્યો અને સ્વયંસેવક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા પ્રયાસો અસાધારણ હતા.